



**DXX-002-002305**

Seat No. \_\_\_\_\_

**M. Com. (Sem. III) (CBCS) Examination**

**May / June - 2015**

**ECT 04 : Accounting & Taxation - IV**

**(New Course)**

**Faculty Code : 002**

**Subject Code : 002305**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

- સૂચના : (૧) બહુ વૈકલ્પિક પ્રશ્નોના જવાબ મુખ્ય ઉત્તરવહીમાં જ આપો.  
(૨) જમણી બાજુના આંકડા પ્રશ્નના ગુણ દર્શાવે છે.

૧ M.C.Q.

૨૦

(૧) Full form of GAAP is Generally Accepted \_\_\_\_\_ principles.

- (A) Accounting (B) Accounts  
(C) Audit (D) Actual

(૨) ભારતીય હિસાબી ધોરણ-૧ નું શીર્ષક શું છે ?

- (A) રોકાયેલી મૂડીની પડતર (B) માલિકીની મૂડીની પડતર  
(C) ઊછીની મૂડીની પડતર (D) આ પૈકી એક પણ નહીં

(૩) પાત્રોના ઉપલક ખાતામાં પાત્રોને લગતી બધીજ વિગતો કઈ કિંમતે દર્શાવાય છે ?

- (A) પ્રમાણ કિંમતે (B) પરત કિંમતે  
(C) પડતર કિંમતે (D) ખરીદ કિંમતે

(૪) આંતર પેઠી તુલનાનો મુખ્ય હેતુ સંચાલનને \_\_\_\_\_ બતાવીને કાર્યક્ષમતા સુધારવાનો છે.

- (A) તમામ ખર્ચની માહિતી  
(B) માત્ર મર્યાદાઓ  
(C) વર્તમાન સિદ્ધિ તથા શક્ય નબળાઈઓ  
(D) ગણાકાપ હરિફાઈનું ચિત્ર

(પ) ધી સેન્ટર ફોર ઈન્ટર ફર્મ કમ્પેરીઝનની સ્થાપના ઈ.સ. \_\_\_\_\_ U.K માં થઈ.

- (A) ૧૯૪૯ (B) ૧૯૬૯  
(C) ૧૯૫૮ (D) ૧૯૫૯

(દ) સંકલિત હિસાબી પદ્ધતિમાં નીચેનામાંથી કયુ ખાતુ ખોલવામાં આવતુ નથી ?

- (A) બેંક ખાતુ (B) મશીનરી ખાતુ  
(C) સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતુ (D) વહીવટી પરોક્ષ ખર્ચ ખાતુ

(૭) નીચેનામાંથી કયુ ખાતુ બિનસંકલિત હિસાબી પદ્ધતિ અને સંકલિત હિસાબી પદ્ધતિ બન્નેમાં ખોલવામાં આવે છે.

- (A) માલસામાન ખાતાવહી નિયંત્રણ ખાતુ  
(B) ચાલુકામ ખાતાવહી નિયંત્રણ ખાતુ  
(C) તૈયાર માલ ખાતાવહી નિયંત્રણ ખાતુ  
(D) ઉપરોક્ત પૈકી દરેક

(૮) સંકલિત હિસાબી પદ્ધતિમાં કયા બે પ્રકારના હિસાબોનું સંકલન કરવામાં આવે છે ?

- (A) પડતરના હિસાબો અને સંચાલકીય હિસાબો  
(B) નાણાંકીય હિસાબો અને સામાજિક જવાબદારીના હિસાબો  
(C) નાણાંકીય હિસાબો અને પડતરના હિસાબો  
(D) ઉપરોક્ત પૈકી એક પણ નહી

(૯) હિસાબી ધોરણો તૈયાર કરવાનું કાર્ય કોનું છે ?

- (A) રાજ્ય સરકાર (B) આઈ.સી.એ.આઈ  
(C) નાણાં મંત્રી (D) સેબી.

(૧૦) આંતર પેઢી તુલના એ એક પ્રકારે \_\_\_\_\_ છે.

- (A) ટેકનિક્સ (B) પદ્ધતિઓ  
(C) સાધનો (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં.

(૧૧) દેવાદારો અંગે નીચે પ્રમાણે માહિતી મળે છે.

શરૂઆતની બાકી રૂ.૨૪૦૦૦, આખરની બાકી રૂ.૨૯૦૦૦ મળેલ ઉધરાણીની રકમ રૂ.૭૨૦૦૦ હોય તો તફાવતની રકમ શું કહેવાય ?

- (A) ઉધાર વેચાણ (B) ઉધાર ખરીદી  
(C) રોકડ વેચાણ (D) ઘાલખાધ

(૧૨) નિયંત્રણ ખાતાઓની પદ્ધતિમાં માલ સામાનનું અસામાન્ય નુકસાન કયા ખાતે ઉધારાય છે ?

- (A) મજૂરી નિયંત્રણ ખાતે  
(B) સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતે  
(C) પડતરના ન.નુ.ખાતે  
(D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં.

(૧૩) બિન સંકલિત હિસાબી પદ્ધતિમાં સામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી કયા ખાતે ઉધારાય છે ?

- (A) પડતરના ન.નુ.ખાતે  
(B) ચાલુકામ ખાતાવહી નિયંત્રણ ખાતે  
(C) કારખાના પરોક્ષ ખર્ચ ખાતે  
(D) સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતે

(૧૪) IFRSનું પૂર્ણ નામ \_\_\_\_\_

- (A) International Financial Reporting Standard
- (B) International Financial Regulation System
- (C) Inter Firm Relation System
- (D) Indian Financial Reporting Standard

(૧૫) ASBનું પૂર્ણ નામ \_\_\_\_\_

- (A) Accounting System Body
- (B) Accounting Standard Body
- (C) Account Standard Board
- (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

(૧૬) ભારતીય હિસાબી ધોરણ-૧૨નું શીર્ષક શું છે ?

- (A) સરકારી હિસાબો
- (B) સરકારી મિલકતોના હિસાબો
- (C) સરકારી અનુદાન અંગેના હિસાબો
- (D) બિન સરકારી આવકો

(૧૭) ભંગાર તરીકે વેચી દીધેલા પાત્રો કયા ખાતે દર્શાવાય છે ?

- (A) પાત્રોના ઉપલક્ષ ખાતે
- (B) પાત્રોની જોગવાઈ ખાતે
- (C) પાત્રોના વેપાર ખાતે
- (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

(૧૮) શેર દીઠ કમાણી એ હિસાબી ધોરણ નં \_\_\_\_\_ છે.

- (A) AS - 18
- (B) AS-22
- (C) AS-19
- (D) AS-20

(૧૯) પાત્રોના હિસાબોમાં ભાડુ એ કોના માટે ખર્ચ છે ?

- (A) ગ્રાહક (B) કંપની  
(C) (A) અને (B) (D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં

(૨૦) નિયંત્રણ ખાતાઓની પદ્ધતિ એટલે \_\_\_\_\_

- (A) સંકલિત હિસાબી પદ્ધતિ  
(B) બિનસંકલિત હિસાબી પદ્ધતિ  
(C) નાણાંકીય હિસાબી અને પડતરના હિસાબોની મેળવણી  
(D) (B) અને (C)

૨ સંયમ મેન્યુ. કંપનીના ચોપડે તા. ૧-૪-૨૦૧૩ના રોજ નીચેની બાકીઓ હતી. ૧૨

વિગત	રૂ.	
* માલ સામાન ખાતાવહી નિયંત્રણ ખાતુ	૬૧,૨૦૦	
* ચાલુ કામ ખાતાવહી નિયંત્રણ ખાતુ	૧૩,૫૦૦	
* તૈયાર માલ ખાતાવહી નિયંત્રણ ખાતુ	૪૫,૩૦૦	
* સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતુ	૧,૨૦,૦૦૦	
વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાનના વ્યવહારોનો સારાંશ નીચે મુજબ છે.		
* વેચાણ	૧૨,૭૫,૦૦૦	
* વેચેલ માલની પડતર કિંમત	૮,૦૦,૦૦૦	
* વર્ષ દરમિયાન ઉત્પાદન માલની પડતર	૮,૭૦,૦૦૦	
* માલ સામાનની ખરીદી	૩,૭૫,૦૦૦	
* ખાસ જોબ માટે માલ સામાનની ખરીદી	૪૨,૦૦૦	
* વેપારીઓને પરત કરેલ માલ સામાન	૩૩,૦૦૦	
* ઉત્પાદન વિભાગને આપેલ :-		
પ્રત્યક્ષ માલ સામાન	૨,૭૦,૦૦૦	
પરોક્ષ માલ સામાન	૮૭,૫૦૦	
* પગાર :-		
વેચાણ ઓફિસ સ્ટાફ	૪૬૫૦૦	-
ઓફિસ સ્ટાફ	૧૨૦૦૦	
ગોડાઉન કિપર	૩૮૦૦૦	૮૭૫૦૦

* પ્રત્યક્ષ મજૂરી		૨,૧૩,૦૦૦
* પરોક્ષ મજૂરી		૬૧,૫૦૦
* કારખાના પરોક્ષ ખર્ચ :-		
	ચૂકવણી	૧,૯૨,૦૦૦
	વસૂલાત	૩,૩૩,૦૦૦
* વેચાણ પરોક્ષ ખર્ચ :-		
	ચૂકવણી	૯૧,૫૦૦
	વસૂલાત	૧,૩૫,૦૦૦
* વિતરણ પરોક્ષ ખર્ચ :-		
	ચૂકવણી	૭૨,૦૦૦
	વસૂલાત	૧,૧૮,૫૦૦
* મુખ્ય ઓફિસરના પરોક્ષ ખર્ચ :-		
	ચૂકવણી	૪૨,૦૦૦
	વસૂલાત	૫૨,૫૦૦

કંપનીના ચોપડે જરૂરી નિયંત્રણ ખાતાઓ તૈયાર કરી તા.૩૧-૩-૨૦૧૪ના રોજનું કાચું સરવૈયુ તૈયાર કરો.

#### અથવા

૨ માહેશ્વરી એન્જી. કંપનીના પડતરના ચોપડામાં તા.૧-૪-૨૦૧૩ના રોજની કેટલીક બાકીઓ નીચે મુજબ હતી. ૧૨

વિગત	ઉધાર રૂ.	જમા રૂ.
* માલસામાન ખાતાવહી નિયંત્રણ ખાતુ.	૬૯૦૦	-
* ચાલુકામ ખાતાવહી નિયંત્રણ ખાતુ.	૩૧,૨૦૦	-
* તૈયાર માલ ખાતાવહી નિયંત્રણ ખાતુ.	૧૩૮૦૦	-
* સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતુ.	-	૫૨,૩૮૦
* કારખાના શિરોપરી ખર્ચનું ખાતુ	૩૦૦	-
* વહીવટી શિરોપરી ખર્ચનું ખાતુ	૧૮૦	-
	૫૨,૩૮૦	૫૨,૩૮૦

વર્ષ દરમ્યાનના વ્યવહારો :

વિગત	રૂ.
* વેચાણ	૧,૨૬,૦૦૦
* માલસામાનની ખરીદી	૩૦,૦૦૦
* ઉત્પાદન માટે આપેલ માલ સામાન	૨૯,૪૦૦
* મજૂરી ચુકવી	૪૮,૦૦૦
* પ્રત્યક્ષ મજૂરી	૪૫,૦૦૦
* ઉત્પાદન ખાતે વસૂલ કરેલ :-	
કારખાના ખર્ચ	૧૩,૨૦૦
વહીવટી ખર્ચ	૭૨૦૦
* વર્ષ દરમ્યાન થયેલ તૈયાર માલની પડતર	૧,૦૮,૦૦૦
* વેચેલ તૈયાર માલ (પડતર કિંમતે)	૧,૧૪,૦૦૦
* સમારકામ માટે આપેલ માલ સામાન	૧૨૦૦
* ઉત્પાદન માટે પૂરા પાડેલ માલ સામાનનું આવક માલ ગાડા ભાડુ	૪૮૦
* વહીવટી પરોક્ષ ખર્ચ	૭૦૨૦
* કારખાના પરોક્ષ ખર્ચ	૮૭૦૦

પડતર ખાતાવહીમાં જરૂરી ખાતા બનાવો અને તા.૩૧-૩-૨૦૧૪ના રોજનું કાચુ સરવૈયુ બનાવો.

- ૩ સલોની લિ. પોતાના હિસાબો સંકલિત પદ્ધતિથી રાખે છે. તા.૧-૪-૨૦૧૩ના રોજની બાકીઓ નીચે પ્રમાણે હતી. ૧૨

વિગત	રૂ	વિગત	રૂ.	વિગત	રૂ
શેર મૂડી	૧,૨૫,૦૦૦	પ્લાંટ-યંત્રો	૧,૨૫,૦૦૦	પર.દેવાદારો	૨૦,૦૦૦
બેંક ઓ.ડી	૪૦,૦૦૦	કાચો માલ	૫૦,૦૦૦	પર.લેણદારો	૩૦,૦૦૦

વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાનના વ્યવહારો :-

વિગત	રૂ	વિગત	રૂ
કાચા માલનો સ્ટોક (૩૧-૩-૨૦૧૪)	૨૬,૦૦૦	દેવાદારો પાસેથી મળ્યા	૩,૦૦,૦૦૦
કાચામાલની ખરીદી	૮૦,૦૦૦	તૈયાર માલનું વેચાણ (વેચાણ કિંમતે)	૨,૮૬,૦૦૦
ઉત્પાદન વિભાગને પૂરો	૧,૦૦,૦૦૦	તૈયાર માલનો સ્ટોક	
પાડેલ કાચોમાલ		ઉત્પાદન ખાતેથી	૧,૮૧,૦૦૦
લેણદારોને ચૂકવ્યા	૮૫,૦૦૦	કારખાના પરોક્ષ ખર્ચ :-	
પ્રત્યક્ષ મજૂરી - ચૂકવેલ	૮૫,૦૦૦	ચૂકવેલ	૮૭,૫૦૦
વેચાણ વિતરણ ખર્ચ	૧૦,૦૦૦	વસૂલાત	૮૩,૦૦૦
		પ્રત્યક્ષ મજૂરી ઉત્પાદન ખાતે ઉધારેલ	૮૩,૦૦૦

જરૂરી ખાતાઓ તૈયાર કરો અને તા.૩૧-૩-૨૦૧૪ના રોજનું કાચુ સરવૈયુ તૈયાર કરો.

અથવા

- ૩ પૂજા લિ. પોતાના હિસાબો સંકલિત પદ્ધતિથી રાખે છે. તા.૧-૪-૨૦૧૩ના રોજની બાકીઓ નીચે પ્રમાણે હતી. ૧૨

વિગત	ઉધાર રૂ	જમા રૂ
માલ સામાન ખાતાવહી નિયંત્રણ ખાતુ	૧,૨૧,૫૦૦	-
ચાલુકામ ખાતાવહી નિયંત્રણ ખાતુ.	૧,૧૪,૭૫૦	-
તૈયાર માલ ખાતાવહી નિયંત્રણ ખાતુ.	૮૭,૭૫૦	-
સ્થિર મિલકતો	૩,૭૧,૨૫૦	-
દેવાદારો અને લેણદારો	૮૧,૦૦૦	૫૪,૦૦૦
બેંક સિલક	૬૭,૫૦૦	-
શેર મૂડી	-	૫,૪૦,૦૦૦
નફા-નુકસાન ખાતું	-	૨,૧૬,૦૦૦
ઘસારાની જોગવાઈ	-	૩૩,૭૫૦
	૮,૪૩,૭૫૦	૮,૪૩,૭૫૦



તા.૩૧-૩-૨૦૧૪ના રોજ પૂરા થતા વર્ષના વ્યવહારો નીચે મુજબ છે.

વિગત	રૂ	વિગત	રૂ
માલ સામાન :		લેણદારોને ચૂકવણી	૬,૮૧,૭૫૦
ખરીદી	૬,૭૫,૦૦૦	દેવાદારો પાસેથી	
સમારકામ માટે આપેલ	૧૩,૫૦૦	ઉઘરાણી વસૂલાત	૧૯,૫૭,૫૦૦
ઉત્પાદન માટે આપેલ	૭,૪૨,૫૦૦	મશીનરીનો ઘસારો	૮૭૭૫
મજૂરી :-		વર્ષ દરમ્યાન	
પ્રત્યક્ષ	૫,૮૭,૨૫૦	પડતર કિંમતે	
પરોક્ષ	૩૩,૭૫૦	તૈયાર માલ	૧૪,૫૧,૨૫૦
ઉત્પાદન પરોક્ષ ખર્ચ :-		વેચેલ માલની પડતર	૧૪,૮૫,૦૦૦
ચૂકવેલ	૨,૭૦,૦૦૦	વેચાણ (ઉધાર)	૨૦,૨૫,૦૦૦
ફાળવેલ	૩,૨૪,૦૦૦		
ચૂકવેલ અને ફાળવેલ :-			
વહીવટી પરોક્ષ ખર્ચ	૮૧,૦૦૦		
વેચાણ પરોક્ષ ખર્ચ	૯૪,૫૦૦		

જરૂરી ખાતા અને કાચુ સરવૈયુ તૈયાર કરો.

૪ અનિતા ફૂડ પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ પ્લાસ્ટીકના કેરબામાં કેરીનો રસ મોકલે છે. ૧૩

દરેક કેરબા દીઠ રૂ.૨૨ કિંમત ગણવામાં આવે છે. જો ગ્રાહકો એક માસમાં કેરબા પરત કરે તો તેમને પ્રત્યેક કેરબા દીઠ રૂ.૧૬.૮૦ જમાં આપવામાં આવે છે.

AFPPLના ચોપડે થી નીચેની માહિતી મળે છે.

તા.૧-૪-૨૦૧૩ના રોજની સ્થિતિ :-

- (i) પરત થઈ શકે તેવા કેરબા (નંગ) ..... ૮૪૦૦
- (ii) કેરબાનો હાથ પર સ્ટોક (નંગ)..... ૧૬૮૦૦
- (iii) પ્રત્યેક કેરબા દીઠ ગણેલ કિંમત .....રૂ.૪.૨૦
- (iv) કેરબાના દેવાદારો (બાકી લેણા) .....રૂ.૪૪,૧૦૦

**વર્ષ ૨૦૧૩-૧૪ દરમ્યાનના વ્યવહારો :-**

- (i) વર્ષ દરમ્યાન રૂ. ૧૦.૫૦ લેખે ખરીદેલા કેરબા ..... ₹૩,૦૦૦
- (ii) વર્ષ દરમ્યાન ગ્રાહકોને મોકલેલ કેરબા ..... ૧૦,૫૦,૦૦૦
- (iii) વર્ષ દરમ્યાન ગ્રાહકોએ પરત કરેલા કેરબા ..... ૧૦,૦૮,૦૦૦
- (iv) માર્ચ-૨૦૧૪ દરમ્યાન ગ્રાહકોને મોકલેલ  
કેરબા કે જે હજુ પરત આવેલ નથી ..... ૨૧,૦૦૦
- (v) વર્ષ દરમ્યાન નુકસાની વાળા વેચેલ કેરબા ..... ૪૨૦૦  
(રૂ. ૧૦,૫૦૦ વેચાણ કિંમત)
- (vi) વર્ષ દરમ્યાન કેરબાના દેવાદારો પાસેથી પ્રાપ્ત થયેલ રકમ ..... રૂ. ૨૩,૧૦,૦૦૦

તા. ૩૧-૩-૨૦૧૪ના રોજ હાથ પર બાકી રહેલા પ્રત્યેક કેરબાની કિંમત તેની પડતર કિંમત કરતા ૫૦% ઓછી ગણવાની છે.

ઉપરોક્ત માહિતી પરથી AFPPL ના ચોપડે નીચેના ખાતાઓ તૈયાર કરો.

- (૧) કેરબાના દેવાદારોનું ખાતું.
- (૨) કેરબાના સ્ટોકનું ખાતું.
- (૩) કેરબાનું વેપાર ખાતું.
- (૪) કેરબાની જોગવાઈનું ખાતું.

**અથવા**

- ૪ મોનિશ લિ. પોતાનો માલ ખોખાઓમાં વેચે છે. જે તે પોતાના ગ્રાહકોને ખોખા દીઠ ૧૩ રૂ. ૫/- લેખે ઉધારે છે. અને જો ગ્રાહક બે માસની મુદતમાં પરત કરે તો તેમને ખોખા દીઠ રૂ. ૩/- લેખે જમા આપવામાં આવે છે.

તા. ૧-૪-૨૦૧૩ના રોજ કારખાનામાં રહેલા બધા ખોખાઓની સંખ્યા ૨૦,૦૦૦ હતી. અને ગ્રાહકો પાસે ૫૦,૦૦૦ હતી. આ બધા ખોખાઓની કિંમત ખોખા દીઠ રૂ. ૨/- ગણવામાં આવે છે.

**વર્ષ દરમ્યાન ના વ્યવહારો :-**

- (૧) ₹૦,૦૦૦ ખોખા રૂ. ૨.૫૦ લેખે ખરીદવામાં આવ્યા હતા.
- (૨) ૧,૦૦,૦૦૦ ખોખા ગ્રાહકોને મોકલવામાં આવ્યા હતા.
- (૩) ૯૦,૦૦૦ ખોખા ગ્રાહકોએ પરત કર્યા હતા.
- (૪) ૨૦૦૦ ખોખા ભંગાર તરીકે રૂ. ૧૦૦૦ માં વેચી નાખેલ છે.

- (પ) ૧૦૦૦ ખોખા આગથી નાશ પામ્યા હતા.
- (દ) તા.૩૧-૩-૨૦૧૪ના રોજ ૫૦,૦૦૦ ખોખા ગ્રાહકોના હાથમાં હતા, જે પરત થઈ શકે તેમ છે.
- (૭) ગ્રાહકો પાસેથી મળેલી રકમ રૂ.૩,૧૫,૦૦૦ છે. ઉપરોક્ત માહિતી પરથી તૈયાર કરો.
- (૧) ગ્રાહકોનું ખાતું
- (૨) ખોખાનું વેપાર ખાતું
- (૩) ખોખાની જોગવાઈનું ખાતું.

૫ આંતર પેઢી તુલનાના ફાયદા અને મર્યાદાઓ જણાવો. ૧૩

#### અથવા

૫ સમાન પડતર પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ જણાવો. ૧૩

### ENGLISH VERSION

Instructions: (1) Give answer of MCQ in main answerbook only.  
(2) Figures to the right side indicate marks.

1 M.C.Q. 20

(1) Full form of GAAP is Generally Accepted \_\_\_\_\_ principles.

- (A) Accounting (B) Accounts  
(C) Audit (D) Actual

(2) What is the title of Indian Accounting standard No. 16 ?

- (A) Cost of employed capital  
(B) Owners Borrowing cost  
(C) Borrowing cost  
(D) None of the above

- (3) At which price all things which are related to packages suspense account are define ?
- (A) Standard price                      (B) Return price
- (C) Cost price                              (D) Purchase price
- (4) The main object of inter firm comparison is \_\_\_\_\_ to define the management for improve the efficiency.
- (A) Detail of expenses
- (B) Only demerits
- (C) Present achievement and ruffles
- (D) Picture of throat-cut competition.
- (5) The center for inter firm comparison was established in which year in U.K. ?
- (A) 1949                                      (B) 1969
- (C) 1958                                      (D) 1959
- (6) Which of the following account is not opened in integrated accounting system ?
- (A) Bank A/c.
- (B) Machinery A/c.
- (C) General Ledger Control A/c.
- (D) Administration overhead A/c.

- (7) Which account of the following is opened in both integrated and non-integrated accounting system ?
- (A) Stock ledger control A/c.
  - (B) Work in progress Ledger Control A/c.
  - (C) Finished Goods Ledger Control A/c.
  - (D) All of the above
- (8) Which of the two accounts are co-ordination in integrated accounting system ?
- (A) Cost accounts and management accounts
  - (B) Financial accounts and social responsibility accounts.
  - (C) Financial accounts and cost accounts
  - (D) None of the above.
- (9) Which body formulates accounting standards ?
- (A) State Government
  - (B) ICAI
  - (C) Finance Minister
  - (D) SEBI.
- (10) Inter firm comparison is one type of the \_\_\_\_\_ .
- (A) Techniques
  - (B) Methods
  - (C) Tools
  - (D) None of the above.
- (11) Following details are available for debtors.
- Opening Balance Rs. 24000, Closing Balance Rs. 29000,  
Cash received from debtors Rs. 72000. What is the amount  
of difference ?
- (A) Credit Sales
  - (B) Credit Purchase
  - (C) Cash Sales
  - (D) Baddebts

- (12) Control accounting system, when there is Abnormal Loss of Material, it is debited to \_\_\_\_\_.
- (A) Labour control A/c.
  - (B) General Ledger Control A/c.
  - (C) Costing P & L A/c.
  - (D) None of the above.
- (13) In non-Integral Accounting system, Normal Idle Time Labour is debited to \_\_\_\_\_.
- (A) Costing P & L A/c.
  - (B) Work in progress Ledger Control A/c.
  - (C) Factory overhead Exp. A/c.
  - (D) General Ledger control A/c.
- (14) Full form of IFRS \_\_\_\_\_.
- (A) International Financial Reporting Standard
  - (B) International financial Regulation System
  - (C) Inter Firm Relation System
  - (D) Indian Financial Reporting Standard
- (15) Full form of ASB \_\_\_\_\_.
- (A) Accounting System Body
  - (B) Accounting Standard Body
  - (C) Account Standard Board
  - (D) None of the above.

- (16) What is the title of Indian Accounting standard No. 12 ?
- (A) Government Accounts
  - (B) Accounts of Government Assets
  - (C) Accounts for Government Grants
  - (D) Non-Government Income
- (17) Packages which are sale as scrap are transferred in which account ?
- (A) Packages suspense A/c.
  - (B) Packages provision A/c.
  - (C) Packages Trading A/c.
  - (D) None of the above.
- (18) "Earning per share" is Accounting standard No. \_\_\_\_\_.
- (A) AS - 18
  - (B) AS-22
  - (C) AS-19
  - (D) AS-20
- (19) In packages accounts rent is expense for \_\_\_\_\_.
- (A) Customer
  - (B) Company
  - (C) (A) and (B)
  - (D) None of the above
- (20) Control Accounting system means \_\_\_\_\_.
- (A) Integrated Accounting system.
  - (B) Non-Integral Accounting system
  - (C) Reconciliation of cost and Financial Accounts.
  - (D) (B) and (C)

2 In the books of SANYAM Manufacturing Co. on date  
1-4-2013, the following balance were :-

12

Particulars	Rs.
* Material Ledger control A/c.	61,200
* Work in progress Ledger control A/c.	13,500
* Finished Goods Ledger control A/c.	45,300
* General Ledger control A/c.	1,20,000

The Conclusion of transactions during the year 2013-14 is as follow.

* Sales	12,75,000
* Cost price of sold goods	9,00,000
* During year : Cost of produced goods	8,70,000
* Material purchase	3,75,000
* Material purchase for particular job	42,000
* Return material to the businessmen	33,000
* Issued to production department :-	
Direct Materials	2,70,000
Indirect Materials	97,500
* Salary :-	
Sales office staff	46500
Office staff	12000
Storekeeper	<u>39000</u>
* Direct wages	2,13,000
* Indirect wages	61,500
* Factory overhead Exp. :-	
Paid	1,92,000
Recovery	3,33,000



* Selling overhead Exp. :-		
Paid		91,500
Recovery		1,35,000
* Distribution overhead Exp. :-		
Paid		72,000
Recovery		1,18,500
* Head Office overhead Exp. :-		
Paid		42,000
Recovery		52,500

Prepare necessary control Accounts and a Trial Balance for date 31-3-2014 in the books of company.

**OR**

- 2 Some balance in the cost ledger of "MAHESHWARI ENGG. CO" Ltd. as on 1-4-2013 were given below : **12**

Particulars	Debit Rs.	Credit Rs.
* Material Ledger control A/c.	6900	-
* Work in progress Ledger control A/c.	31,200	-
* Finished Goods Ledger control A/c.	13,800	-
* General Ledger control A/c.	-	52,380
* Factory overhead exp. A/c.	300	-
* Administrative overhead exp. A/c.	180	-
	<b>52,380</b>	<b>52,380</b>

**Transaction incurred during the year :-**

Particulars	Rs.
* Sales	1,26,000
* Material purchase	30,000
* Material issued for production	29,400
* Wages :- Paid	48,000
* Direct wages	45,000
* Recovered in production account :-	
Factory expenses	13,200
Administrative exp.	7200
* Cost of finished goods during the year	1,08,000
* Finished goods sold (on cost price)	1,14,000
* Material issued for repairing	1200
* Cartage inward of the material issue for production	480
* Administrative overhead Exp.	7020
* Factory overhead Exp.	8700

Prepare necessary control accounts in the cost ledger and also prepare Trial Balance as on dt. 31-3-2014.

**3** Saloni Ltd. keeps its accounts as the integrated method. **12**

The balances are as following on date 1-4-2013.

Particulars	Rs.	Particulars	Rs.	Particulars	Rs.
Share capital	1,25,000	Plant & Machinery	1,25,000	Sundry debtors	20,000
Bank over draft	40,000	Raw Materials	50,000	Sundry creditors	30,000

**Transaction during 2013-14 :-**

<b>Particulars</b>	<b>Rs.</b>	<b>Particulars</b>	<b>Rs.</b>
Raw materials stock (31-3-2014)	26,000	Received from debtors	3,00,000
Raw materials purchase	80,000	Selling of finished goods (on sales price)	2,86,000
Issued raw materials to production department	1,00,000	Finished goods stock from production A/c.	1,91,000
Paid to creditors	85,000	Factory overhead Exp.:	
Direct wages paid	95,000	Paid	87,500
Selling - distribution Exp.	10,000	Recovery	93,000
		Direct wages debited to production A/c.	93,000

Prepare necessary accounts and trial balance for date 31-3-2014.

**OR**

- 3** Pooja Ltd. keeps their accounts on integral system. **12**  
Following are the balances of the company as on date 1-4-2013.

<b>Particulars</b>	<b>Debit Rs.</b>	<b>Credit Rs.</b>
Stores Ledger control A/c.	1,21,500	-
Work in progress ledger control A/c.	1,14,750	-
Finished stock Ledger control A/c.	87,750	-
Fixed Asset	3,71,250	-
Debtors and Creditors	81,000	54,000
Bank Balance	67,500	-
Share Capital	-	5,40,000
P & L A/c.	-	2,16,000
Provision for Depreciation	-	33,750
	<b>8,43,750</b>	<b>8,43,750</b>

Following are the transactions for the year ended on dated  
31-3-2014.

Particulars	Rs.	Particulars	Rs.
Material :-		Payment to creditors	6,81,750
Purchased	6,75,000		
Issued for repairing	13,500	Collection from	
		Debtors	19,57,500
Issued for production	7,42,500	Depreciation on	
Wages :-		Machinery	8775
Direct	5,87,250	Finished goods at	
Indirect	33,750	cost during year	14,51,250
		Cost of goods sold	14,85,000
Production overheads :-		Sales (Credit)	20,25,000
Paid	2,70,000		
Allocated	3,24,000		
Paid & Allocated :-			
Administrative overheads	81,000		
Selling overheads	94,500		

Prepare necessary accounts and Trial Balance.

- 4 Anita Food Processing Private Ltd. send Mango Pulp in plastic Jars. It is priced at Rs. 22 per Jar. If the customer return the Jars within a month, Rs. 16.80 is credited per Jar. 13

AFPPL Book's details is as under :-

**The position of as on dt. 1-4-2013 :-**

(i)	Returnable Jars .....	8400
(ii)	Jar's stock in hand .....	16800
(iii)	The Price calculated for each Jar. ....	Rs.4.20
(iv)	Debtors of Jar [Remaining Balance] .....	Rs.44,100

**Transaction during the year 2013-14 :-**

(i)	Each Jar bought at Rs. 10.50 during the year .....	63,000
(ii)	Jars sent to the customer during the year .....	10,50,000
(iii)	Jars returned by the customers during the year. ...	10,08,000
(iv)	Jars sent to the customers in March-14, which are not returned yet. ....	21,000
(v)	Damaged Jars sold during the year [Sales price Rs.10,500] .....	4200
(vi)	Received cash from the debtors of Jars during the year .....	Rs. 23,10,000

Consider as on the 31-3-2014 the cost of each remaining Jar is 50% less of its cost price. From the above details, Prepare following accounts in AFPPL Books.

- (1) Jars Debtors A/c.
- (2) Jars Stock A/c.
- (3) Jars Trading A/c.
- (4) Jars provisions A/c.

**OR**

- 4 Manish Ltd. sells its product in returnable boxes which are charged at Rs. 5/- to its customers. If customers return boxes within Two months, they are credited worth Rs. 3/- per boxes. 13

On 1-4-2013 the number of boxes in the factory were 20,000 and with customers 50,000. All the stock of boxes was valued at Rs. 2/- each.

**Transactions during the year :-**

- (1) 60,000 Boxes were purchased, at Rs. 2.50.
- (2) 1,00,000 Boxes were sent to customers.
- (3) 90,000 Boxes were returned by customers.
- (4) 2000 Boxes were sold as a scrap for Rs. 1000.
- (5) 1000 Boxes were destroyed by fire.
- (6) 50,000 Boxes were returnable with customers on 31-3-2014 .
- (7) Cash received from customers Rs. 3,15,000 from above details prepare :-
  - (1) Customers A/c.
  - (2) Boxes Trading A/c.
  - (3) Boxes Provisions A/c.

5 Explain the merits and demerits of Inter-firm comparison. 13

**OR**

5 Explain the merits and demerits of uniform costing. 13

---